



BRAMPTON

Service and Information Update

COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં ઈસ્ટર વીકએન્ડ 2021

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 25, 2021) – આ વર્ષે, ગુડ ફ્રાઈડે શુક્રવાર, એપ્રિલ 2 નાં રોજ આવશે અને ઈસ્ટર મન્ડે સોમવાર, એપ્રિલ 5 નાં રોજ આવશે.

સમુદાયને સહાયરૂપ થવા અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓનું સંચાલન રાખેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહાર) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે અથવા ઈમેઈલ સરનામું 311@brampton.ca પર ઈમેઈલ મોકલી શકે છે. અમે COVID-19 સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 જુઓ.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એપ્રિલ 2 થી 5 સુધી નીચેના સર્વિસ લેવલ્સમાં સંચાલિત રહેશે.

શુક્રવાર, એપ્રિલ 2 (ગુડ ફ્રાઈડે)

રવિવાર/ રજાના દિવસના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

શનિવાર, એપ્રિલ 3

શનિવારના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ નિયમિત ક્લાકો દરમિયાન ખુલ્લા રહેશે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

રવિવાર, એપ્રિલ 4 (ઈસ્ટર મન્ડે)

રવિવાર / રજાના દિવસના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

સોમવાર, એપ્રિલ 5 (ઈસ્ટર મન્ડે)

અઠવાડિક કામકાજ દિવસના નિયમિત સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ નિયમિત ક્લાકો દરમિયાન ખુલ્લા રહેશે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી માટે, કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.bramptontransit.com જુઓ.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજીંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માસ્ક પહેર્યો હોય તો પણ, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવાની વિનંતી કરે છે.

ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર



ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર તમારું નાક, મોઢું અને દાઢી ઢાંકતા ચુસ્ત બંધબેસતા નોન-મેડિકલ મારક્સ પહેરવા અનિવાર્ય છે. સીટી ઓફ બ્રમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

બ્રમ્પટન રિક્રિએશન

બની ઍગસાઈટમેન્ટ (Bunny EGGScitement)

આ ઈસ્ટર પર બની ઍગસાઈટમેન્ટની સુરક્ષિત આવૃત્તિ સાથે મોજ માણો! છોડના રંગીન કુંદા બનાવવા એક ક્રાફ્ટ કિટ ઉઠાવો અને ઓનલાઈન ટ્યુટોરિયલ અનુસરો, વર્યુઅલ ઍગ હંટિંગ (ઈંડા શોધવાની રમત)માં ભાગ લો, અને માર્ચ 29 થી શરૂ થતી રંગીન પ્રવૃત્તિઓ ડાઉનલોડ કરો.

સંપર્કવિહીન, કર્બસાઈડ ક્રાફ્ટ કિટ પિક-અપ માર્ચ 31 અને એપ્રિલ 1 નાં રોજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી કેસી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર, ચિંગકુસી પાર્ક સ્કી ચેલેંટ, ગોર મીડોસ કમ્યુનિટી સેન્ટર, અને સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં ઉપલબ્ધ છે. કૃપા કરી પિક-અપ દરમિયાન સ્થળ પરના બધાં સાઈનબોર્ડ્સ અને સુરક્ષા સૂચનો અનુસરો. ક્રાફ્ટ કિટ્સ વહેલો તે પહેલો ધોરણે ઉપલબ્ધ છે અને જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી કુટુંબ દીઠ એક નંગ સુધી સીમિત રહે છે.

ફન બની ઍગસાઈટમેન્ટ પ્રવૃત્તિઓ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ.

રેક એટ હોમ (Rec At Home)

ઘરે ઓનલાઈન ફિટનેસ અને ક્રાફ્ટ ટ્યુટોરિયલ્સ વડે સક્રિય અને પ્રવૃત્તમય રહો! સંપૂર્ણ બોડી સરકિટ અજમાવી જુઓ, ઓરિગામી હાટ્સ બનાવતા શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બધાંનો મહાવરો કરો. રેક એટ હોમ (Rec At Home) પ્રવૃત્તિઓ પર અહીંથી પહોંચો

www.brampton.ca/recathome.

પ્રોવિન્સના COVID-19 લોકડાઉન ઉપાયોને અનુરૂપ પ્રતિક્રિયા કરવામાં સીટી ઓફ બ્રમ્પટનના રિક્રિએશન સેન્ટર્સ હંગામી ધોરણે બંધ રહે છે અને રૂબરૂમાં ઈન્સ્ટ્રક્ટરની આગેવાનીમાં મનોરંજન કાર્યક્રમો અને સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વર્યુઅલ અને આઉટડોર મનોરંજન કાર્યક્રમો અને સેવાઓ પર માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/recreation.

બ્રમ્પટન લાઈબ્રેરી

બધી લાઈબ્રેરી શાખાઓમાં શુક્રવાર, એપ્રિલ 2 (ગુડ ફ્રાઈડે) નિમિત્તે બ્રાંચમાં અને કર્બસાઈડ પિક-અપ સેવાઓ અનુપલબ્ધ રહેશે.

અમારી ડિજિટલ લાઈબ્રેરી કોઈપણ સમયે જોવા [બ્રમ્પટન લાઈબ્રેરીની વેબસાઈટ](http://www.brampton.ca/laibry) જુઓ. અહીં તમે તમારા લાઈબ્રેરી કાર્ડ વડે ડિજિટલ ઈ-બુક્સ, ઈ-ઓડિયો બુક્સ, ટીવી અને મૂવી સ્ટ્રીમિંગ, ઓનલાઈન લર્નિંગ, અને આટ્સ અને ક્રાફ્ટ્સ અને ઘણું બધું સુધી મફતમાં પહોંચ મેળવશો. [બ્રમ્પટન લાઈબ્રેરી કાર્ડ મેળવવા, કૃપા કરી અહીં ક્લિક કરો.](http://www.brampton.ca/laibry) બધી શાખાઓમાં 24-કલાકના બાહ્ય ટ્રોપ બોક્સીસ મારફતે તમે ઊછીનું લીધેલું સાહિત્ય પરત કરવાની લચીલી સેવાઓ મેળવો.

ચાલો આપણે સંપર્કમાં રહીએ! અમારી ઈમેઈલ અપડેટ્સ સબસ્ક્રાઈબ કરો અને અમને [Facebook](https://www.facebook.com/brampton), [Twitter](https://twitter.com/brampton), અને [Instagram](https://www.instagram.com/brampton) પર અનુસરો.

બ્રમ્પટન એનિમલ સર્વિસીસ



બ્રેમ્પટન એનિમલ શેલ્ટર ગુડ ફ્રાઇડે એપ્રિલ 2, ઈસ્ટર સન્ડે એપ્રિલ 4 અને ઈસ્ટર મન્ડે એપ્રિલ 5 નાં રોજ બંધ રહેશે. આ શેલ્ટર શનિવાર, એપ્રિલ 3 નાં રોજ, માત્ર એપોઈન્ટમેન્ટથી, સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર હોય છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઈજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ કરવી
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવું
- મરેલું પ્રાણી લઈ જવું

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

ઈસ્ટર વીકએન્ડ માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ

ઈસ્ટર હોલિડે પર માત્ર તમારી સાથે રહેતા લોકો સાથે ભેગા થઈને એકબીજાની સંભાળ રાખશો. વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલુ હોવા છતાં, આપણે આપણાં સંસ્પર્શમાં ઊણપ ન જ રાખવી અને જાહેર આરોગ્યની સલાહ અનુસરવાનું ચાલુ રાખવું રહેશે. આ ક્રિયાઓ વાઈરસ સામે આપણો શ્રેષ્ઠ બચાવ બની રહે છે. તમારા ઘરની બહાર રહેતા કુટુંબીજનો અને મિત્રો માટે, ફોટા પાડો અને એકબીજા સાથે સંકળાયેલા રહેવા વર્ચ્યુઅલ કોલ્સ કરો અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવો. ફેલાવાનું જોખમ ઘટાડવા વર્ચ્યુઅલ ભેગા થવાના વિકલ્પો માટે તમારા પ્રાર્થના સ્થળે પૂછપરછ કરો. જો તમારે રૂબરૂમાં ભેગા થવું જ પડે તો, કૃપા કરી ધાર્મિક સેવાઓ માટે ભેગા થવાની સીમાઓ અનુસરો.

-30-

સીટી ઓફ બ્રેમ્પટન મીડિયા સંપર્ક

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

રીજીયન ઓફ પીલ મીડિયા સંપર્ક

એશલી હોકિન્સ (Ashleigh Hawkins)

કમ્યુનિકેશન્સ સ્પેશિયલિસ્ટ – જાહેર આરોગ્ય

રીજીયન ઓફ પીલ

416.818.4421 | ashleigh.hawkins@peelregion.ca